



May 17, 2021

DCS-CRD National Stock Exchange of India Limited Exchange Plaza Bandra Kurla Complex Bandra (East) Mumbai - 400 051 Symbol: ADFFOODS	DCS-CRD BSE Limited Department of Corporate Services Phiroze Jeejeebhoy Towers Dalal Street Mumbai - 400 001 Scrip Code: 519183
--	---

Dear Sir/Madam,

Subject: Intimation of Newspaper Publication - Notice of Board Meeting to be held on May 24, 2021.

This is to inform your good-self that in compliance with Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Newspaper advertisement dated May 13, 2021 for the Notice of the Meeting of the Board of Directors to be held on Monday, May 24, 2021 at Mumbai, *inter-alia*, to consider and approve the Audited Financial Results of the Company for the Fourth Quarter and Financial Year Ended March 31, 2021 and also to consider recommendation of Final Dividend on the equity shares of the Company for the F. Y. 2020-21, if any subject to approval of the shareholders in the ensuing Annual General Meeting was published on May 14, 2021 in "Western Times" - Ahmedabad Edition in Gujarati and English language circulating at Nadiad, where the Registered Office of the Company is situated. Enclosed herewith please find the copies of the publication for your kind reference.

Kindly take the note of the same and oblige.

Thanking you.

Yours faithfully,
For **ADF Foods Limited**

Shalaka Ovalekar
Company Secretary

Encl: A/a



Regd Off: 83/86, G.I.D.C Industrial Estate, Nadiad - 387 001, India. Tel.: +91 268 2551381/82 Fax: +91 268 2565068
Email: nadiadfactory@adf-foods.com CIN: L15400GJ1990PLC014265
Corp. Off: Marathon Innova, B2, G01, Ground Floor, G. K. Road, Lower Parel, Mumbai 400 013. INDIA.
Tel.: +91 22 6141 5555, Fax: +91 22 6141 5577, Email: info@adf-foods.com, Web: www.adf-foods.com

LANXESS raises guidance for fiscal year 2021 Sales of EUR 1.693 billion at good prior-year level

Mumbai, LANXESS is raising its guidance for the full year 2021 following a good first quarter: The specialty chemicals company now expects EBITDA pre exceptional of between EUR 950 million and EUR 1 billion. Previously, the company had assumed earnings of between EUR 900 million and EUR 1 billion. At EUR 242 million, EBITDA pre exceptional in the first quarter came in at the good level of the prior-year quarter (EUR 245 million), which had not yet been significantly affected by the coronavirus pandemic. Group-wide, volumes in the first quarter of 2021 were above the prior-year level. Growing demand from the automotive sector was a key

driver, particularly in the Engineering Materials segment. This was offset by the effects of weather-related production shutdowns in the United States in the Advanced Intermediates, Specialty Additives and Con-



sumer Protection segments. Moreover, negative exchange rate effects, particularly from the US dollar, and significantly higher energy costs, especially in Germany, had a negative impact. Group sales in the first quarter of EUR 1.693 billion were at the good level of the

previous year (EUR 1.704 billion). Group income from continuing operations also remained stable at EUR 63 million.

"The positive momentum from the fourth quarter has continued and we have made a good start to the new year.

We are benefiting from a further increase in demand, particularly in the automotive sector. Operationally, we have thus left Corona behind us and are now very confident about the rest of the year," said Matthias Zachert, Chairman of the Board of Management of LANXESS AG. "Now we are focusing on our growth course and are doing everything we can to ensure that our new businesses quickly develop their full potential."

Cairn Oil & Gas commences production from its tight oil project at Aishwariya Barmer Hills

Jaipur, Cairn Oil & Gas, Vedanta Limited, India's largest private oil and gas exploration and production company, has achieved a significant milestone by starting production from its NA #01 facility in Aishwariya Barmer Hills in Rajasthan. The project is a first in Cairn's tight oil portfolio with a growth potential to contribute 20% to the company's vision production.

The project has been executed in collaboration with leading global oilfields services company, Schlumberger. It took more than 900 days and over 3 million man-hours to complete the entire surface facility, including activities like hot work, equipment erection, hydro testing, hot tapping, commissioning, electrical system charging, tie-in with a live existing facility,

and well hookup. More than 600 contractors and 50 contractor engineers, in addition to Cairn's engineers worked tirelessly to complete the facility.

Speaking about the project, PrachurSah, Deputy CEO, Cairn Oil & Gas, Vedanta Ltd., said, "The ABH tight oil project is yet another example of our commitment to growing India's E&P sector through the deployment of advanced technologies. It is also a testament to India's hydrocarbons potential, wherein we have been successful in enhancing production from ageing fields. We will continue to explore ways in which we can add to domestic production of crude oil and advance the nation towards energy self-sufficiency." Gautam Reddy, Managing Director, India and Bangladesh, Schlumberger, said, "Schlumberger thanks

Vedanta for the opportunity to work together as growth partners to achieve Vedanta's vision to produce 50% of India's oil and gas. The partnership has witnessed operational excellence while maintaining safety and operations integrity as the top priority. Some achievements include completing the longest horizontal lateral in India via cutting-edge technologies like PowerDrive* Rotary Steerable System along with ROPO* digital drilling optimizer, Periscope HD* Real time boundary mapping service & Broadband Precision* Integrated completion service. Efficient planning and execution, teamwork, and the spirit of collaboration enabled a 30% increase in reservoir coverage and up to 700% improvement in hydraulic fracturing operational efficiency."

Business Brief

Hathi Masala launches Coriander Cumin Powder pack

Ahmedabad: Coriander Cumin Powder is a natural antioxidant and can help boost the immune system. Hathi Masala has launched a new and accessible pocket-friendly packaging of its signature Coriander Cumin Powder Special for the convenience of its customers. Considering the usefulness, benefits, and demand of pure Coriander Cumin Powder, new Coriander Cumin Powder Special has been introduced by the company in a brand-new pouch packing priced at only Rs. 5 (15 grams) and Rs. 10 (20 grams). Hathi Masala produces an impressive 200 tonnes of its signature Coriander Cumin Powder annually compiling all the national and international standards, experience, in-depth research, and state-of-the-art technology. The unique blend of Hathi Masala's Coriander Cumin Powder is known for a distinctive taste and aroma. The mixture adds flavour to a dish and is widely used in Indian cuisine. Hathi Masala's mixture is rich with oleoresin oils and core essence.



Super Cute's WonderShorts and WonderSkirts diapers are summer essentials for babies

Mumbai, The scorching Indian summer is here and it's time for mothers to help their babies beat the heat in comfort and style while maintaining utmost hygiene. Super Cute's, India's first ultra-thin premium baby diaper pants is just the right product to keep your baby active and cool throughout the season and it is convenient for mummies too. The one-of-a-kind "Super Cute's WonderShorts and WonderSkirts" diapers for babies come attached with shorts and skirts to make them wearable breezy bottoms, ideal for summers. Mr. Sahil Dharia, Founder & CEO, Soothe Healthcare adds, "We are excited for young Indian parents to try out our line of "functional fashion diapers," so their babies have an enjoyable and soothing summer. The WonderShorts and WonderSkirts diapers will ensure the two most important things when it comes to babies - comfort and cuteness. Our product innovation is designed to meet the evolving needs of parents and safeguard their Super Cute's hygiene through every season."

Delaying 2nd Covid vax dose in under 65 may cut deaths: Study

New York, A team of US researchers has found that delaying the second dose of Covid-19 vaccines, at least for people aged under 65, could result in up to 20 per cent lower mortality, but only under certain conditions. These conditions include a one dose vaccine effectiveness (efficacy) of 80 per cent or higher and vaccination rates of 0.1 per cent to 0.3 per cent of the population per day, according to the study, published by The BMJ.

If these conditions apply, the strategy could prevent between 47 and 26 deaths per 100,000 people, respectively, the study noted. "Decision makers will need to consider their local vaccination rates and weigh the benefits of increasing these rates by delaying a second dose versus the risks associated with the remaining uncertainty in this strategy," write researchers including Thomas C. Kingsley, Assistant Professor of Medicine at Mayo Clinic, Minnesota.

"These decisions should continue to be re-evaluated as new data become available," the researchers added. Both the Pfizer and Moderna covid-19 vaccines in a standard two dose schedule are highly effective at preventing symptomatic infections and death. But immunity worldwide remains low, partly owing to low vaccination rates.

Tesla applies brakes on Bitcoin for vehicle purchases

San Francisco, After less than two months of going bullish on Bitcoin, Tesla on Thursday applied brakes on the popular cryptocurrency as a payment mode to buy its electric vehicles, citing environmental harm. Musk said that the electric car maker will not sell any bitcoin and intends to use bitcoin for transactions as soon as mining moves to more sustainable energy. "We are also looking at other cryptocurrencies that use

Asus unveils ZenFone 8, ZenFone 8 Flip

Taipei, After postponing India launch of its much-anticipated smartphones due to the Covid-19 crisis, Taiwanese tech giant ASUS has unveiled its ZenFone 8 and ZenFone 8 Flip for the global market.

The new ZenFone 8 and ZenFone 8 Flip starts at a 599 and a 799, respectively. Both the smartphones are powered by Snapdragon 888 chipset and support 5G. The ZenFone 8 features a 5.9-inch 1080p OLED display with a fast 120Hz refresh rate. It will be sold in configurations of up to 16GB RAM and 256GB of storage and includes an IP68 waterproof rating.

The smartphone houses a 64MP Sony IMX686 primary sensor paired with a 12MP Sony IMX363 secondary sensor that has an f/2.2 ultra-wide lens. For selfies and video chats, ZenFone 8 has a 12MP Sony IMX663 camera at the front. This camera features Optical Image Stabilization (OIS) and can record 8K video at 24fps (with EIS enabled).

Fuel prices unchanged on Thursday

New Delhi, Fuel retailers spared consumers of any further increase in fuel prices by keeping retail prices of petrol and diesel unchanged on Thursday.

Accordingly, petrol continues to cost Rs 92.05 per litre and diesel Rs 82.61 in Delhi. Across the country as well the petrol and diesel price crosses remained static on Thursday but its actual retail prices varied depending on the level of local levies in respective states. In Mumbai, regular petrol now comes for Rs 98.36 a litre just five days away from crossing the historic level of Rs 100 per litre. Petrol prices in some states including Rajasthan, Madhya Pradesh and in some places in Maharashtra have breached the Rs 100 per litre mark while premium petrol has been hovering above that level for some time now.

Before Thursday's price hold, fuel prices increased for three consecutive days this week up to Wednesday. Petrol and diesel prices also increased on four consecutive days last week. Petrol prices have increased by Rs 1.50 a litre Delhi in May in the seven increases so far. Similarly, diesel prices have risen by Rs 1.88 per litre in capital this month.

India smartphone shipments forecast down to 170M units in 2021

New Delhi, The current Covid wave has hit the smartphone players in India and the market is likely to see a decline of nearly 12 million units — from 182 million to 170 million — for the year, a new report forecast on Thursday. India's smartphone market will definitely witness a significant dip of more than 30 per cent in the ongoing second quarter (April-June period) and the festive season and pent-up demand are expected to drive the market in Q3 and Q4, according to Counterpoint Research. Consumers will prefer online channels for buying smartphones due to Covid-19 fears. India's smartphone shipments grew 23 per cent (on-year) in Q1 to reach over 38 million units.

"The current COVID-19 wave will have an impact on the coming quarters, with Q2 2021 being impacted the most. We have cut our Q2 2021 forecast by more than 30 per cent compared to the previous forecast," the report showed.

"The uncertainty will prevail in the market till June or July before we see demand coming back strongly during the festive season in late Q3 and early

Q4," it added. The demand for smartphones has already been impacted in April (and now May) due to a surge in COVID cases and restrictions/lockdown in various states. "We believe that the shipments will witness a dip of 35-40 per cent of the BAU (business-as-usual), which corresponds to 7-8 million shipments in April. With the COVID rate, still not declining, it is not likely that the market would return to a business as-usual state before Q3 2021," said Counterpoint Research.

"We have reduced our smartphone forecast for Q2 2021 to 26 million units from 39 million units, our previous forecast."

Overall, the Indian smartphone market is estimated to grow by 12 per cent (YoY) to reach 170 million units in 2021.

"The online segment grew in 2020 despite the overall market registering negative growth. Online channels will be leveraging the festive season sales to drive the market. Device affordability will be a major factor in driving up the volumes," the report said.

The year will also see the adoption of 5G devices in India.

Ethereum founder donates \$1.14bn in crypto to Covid-hit India

New Delhi, Vitalik Buterin, the Russia-based co-founder of the world's second largest cryptocurrency Ethereum, has donated 500 coins and over 50 trillion SHIB meme coin worth around \$1.14 billion to the India

Covid-Crypto Relief Fund, as the country grapples with the lethal second wave of the pandemic.

Sandeep Nailwal, the man behind India Covid-Crypto Relief Fund, said in a tweet late on Wednesday

that they will not "do anything which hurts any community specially the retail community involved with \$SHIB"

"Plz don't worry \$SHIB holders," he said as the meme coin transaction created panic among some investors.

The SHIB meme coin fell more than 35 per cent after the donation.

The meme coin has garnered billions of dollars worth of investment in recent days, reports TechCrunch.

"A number of entrepreneurs including Balaji Srinivasan have donated to the India Crypto Relief Fund, which maintains a log of all the donations," the report mentioned.

Buterin is a Russian-Canadian programmer and writer who is best known as one of the co-founders of Ethereum.

One Ethereum is currently priced for Rs 2.88 lakh.

Buterin became involved with cryptocurrency early in its inception, co-

founding Bitcoin Magazine in 2011.

In 2013, he visited developers in other countries who shared his enthusiasm for code. He returned to Toronto later and published a white paper proposing Ethereum.

He dropped out of university in 2014 when he was awarded with a grant of \$100,000 from the Thiel Fellowship, a scholarship created by venture capitalist Peter Thiel and went to work on Ethereum full-time.

Indian PC market surges to 3.1M units in Q1 2021: IDC

New Delhi, Riding on remote work and learning as the pandemic continues in India, the traditional PC market (inclusive of desktops, notebooks and workstations) continued its growth streak with shipments growing 73.1 per cent year-over-year (YoY) to reach 3.1 million units in the first quarter this year, an IDC report showed on Thursday.

The Q1 recorded the highest ever first-quarter shipments to India. Notebooks again remained the driving category with more than three-fourths share of the PC category, registering a 116.7 per cent YoY growth. Additionally, the desktop category remained steady and showed initial signs of recovery. Many companies remodel to manage the growing concerns of the pandemic within the country. "As cases continued to rise, a few large enterprises procured PCs in bulk to manage their workforces, adopting these new working models for the long haul," said Bharath Shenoy, market analyst, PC Devices, IDC India.

AirTag used to successfully track mailed package across UK

London, An Apple customer in the UK has successfully used Apple's Find My network to track an AirTag as it was being sent by mail to a friend in a completely different city.

Outlined in a blog post at Intego, Kirk McElhearn said he taped an AirTag to a piece of card, wrapped it inside a small bubble envelope and then sent it on its way.

Kirk lives in the small town of Stratford-upon-Avon and he shipped his AirTag to a friend near

London, MacRumors reported.

Using the aCEFind My app on his iPhone, Kirk said he was able to keep track of his AirTag whereabouts, including its arrival at a shipping facility and a "highly automated mail processing centre." What's worth noting is that Apple uses its aCEFind My network, which crowdsources anonymous data from aCEiPhoneCE and iPad devices, in the area to pinpoint the location of an AirTag, the report said.

Blue Dart Med-Exp to test UAS for vax deliveries

New Delhi, Logistics company Blue Dart, part of the Deutsche Post DHL Group (DPDHL), has formed Blue Dart Med-Express Consortium with the mission of revolutionizing the delivery of vaccines and emergency medical supplies to the remotest parts of India with Drones amid the surging second wave.

Blue Dart Med-Express Consortium is part of the 'Medicine from the Sky' project in collaboration with the Government of Telangana, World Economic Forum, Niti Aayog and Healthnet Global.

The Ministry of Civil Aviation (MoCA) has granted the project with necessary exemptions and rights to fly drone flights on an experimental basis in Telangana.

The aim is to assess an alternate logistics route in providing safe, accurate and reliable pickup and delivery of health care items from distribution centre to specific location and back.

Blue Dart Med-Express Drone flights will deploy an immersive delivery model to optimize the current healthcare logistics within Telangana. The model will enable deliveries from district medical stores and blood banks to Primary Health Centers (PHCs), Community Health Centres (CHCs), Blood Storage Units & further from PHCs/CHCs to Central Diagnostic laboratories.

Balfour Manuel, Managing Director, Blue Dart said, "It's been over a year and our battle against COVID-19 continues to unfold new challenges that need solutions in real-time. The pandemic has taught each one of us the importance of logistics and the need for a

tech-led supply chain infrastructure. As an organization Blue Dart has always been surrounded with the technology of the future. It is this ability that has helped us to not only withstand the pandemic but thrive with growth. While we reach out to over 35,000 locations across the country, the current situation calls for a much deeper penetration of vaccines."

Commenting on Blue Dart's experiment with Drone flights for Beyond Visual Line of Sight delivery of vaccines Ketan Kulkarni, CMO & Head - Business Development.

RAI seeks capital support for retail industry amid pandemic

New Delhi, Retailers Association of India (RAI) has urged the government to take steps for capital infusion into the retail industry with ECLGS benefits and loan moratorium.

Speaking about the state of the Indian Retail Industry, Kumar Rajagopalan, CEO, RAI, said: "The retail industry in India has been in a perpetual paradox ever since the first set of restrictions began last year in March 2020. The businesses

and the workforce in retail need to be cushioned by the government or the local authorities to ease off their hardships."

He further said that two most important and immediate steps that can prevent this industry from collapsing are to prioritise vaccination of the last mile workers and to urgently provide financial support. RAI noted that as the days of the

lockdown drag on, it is getting increasingly difficult for retailers to retain employees and to keep their businesses afloat. Retailers need to pay salaries, minimum electricity, rentals, property taxes etc. even if the businesses are shut due to the lockdown. The cash inflow of the industry has come to a standstill, while the fixed operating cost remains intact.

WESTERN RAILWAY - RAJKOT DIVISION

SIGNALING WORK
E-Tender No.: DRM-RJT-21-22-SnT-E-03 Dt. 10.05.2021
Address of the Office: Divisional Railway Manager (S&T), Western Railway, Kothi Compound, Rajkot-360 001. Website particular: www.ireps.gov.in Tender No.: DRM-RJT-21-22-SnT-E-03 Dt. 10.05.2021
Name of Work: Signaling work in connection of Extension of Line No.1 dead end with Trap Point in for stabilizing of "Pilgrim Special" in DWARKA (DWK) station Rajkot Division. Approx. Cost: ₹ 17,17,815.22 (Seventeen Lakh Seventeen Thousand Eight Hundred Fifteen and Twenty Two Paise Only). Earnest Money: ₹ 0.00 (Zero). Tender Cost: ₹ 2000.00 (Two Thousand Only). Date & Time for online apply: on Dt. 11.06.2021 upto 15:00 hours. RJT-07
Like us: www.facebook.com/WesternRly

WESTERN RAILWAY - RAJKOT DIVISION

PROVISION OF EL ALTERATION WORK
Address of the office: Divisional Railway Manager (S&T), Western Railway, Kothi Compound, Rajkot-360 001 Web site particular: www.ireps.gov.in. 1. Tender No: DRM-RJT-21-22-SnT-E-04 Dt. 10-05-2021.
Name of work:- Provision of El Alteration work in connection with Limited Height Sub-Way at LC No.246 at Km 898/9-899/0 between Khambhalya-Bhatel - Rajkot Division. Approx. Cost: Rs.1451400.00 (Rs. Fourteen lakh fifty one thousand four hundred only). Earnest Money : Rs.0.00 (Zero). Tender cost : Rs.2000.00 (Two thousand only). Date & time for online apply: on Dt.11-06-2021 upto 15:00 hours. RJT-08
Like us: www.facebook.com/WesternRly

PUBLIC NOTICE

ENVIRONMENTAL CLEARANCE
It is hereby informed that the State level Environment Impact Assessment Authority, Gandhinagar, Gujarat has accorded the Environment Clearance for setting up of the proposed manufacturing of Synthetic Organic Chemicals by M/s. POLESTAR INDUSTRIES Plot No.616, GIDC Industrial Estate, Ankleshwar, Dist. Bharuch, Gujarat. Vide File No: SEIAA/GUJ/EC/5(f)/474/2021 dated 19th April, 2021. A copy of the clearance letter is placed at office of Gujarat Pollution Control Board (Ankleshwar & Gandhinagar) and may also be seen at website of State level Environment Impact Assessment Authority, Gandhinagar, Gujarat at http://seiaa.gujarat.gov.in/ Sd/- Director

ADF Foods Limited

CIN: L15400GJ1990PLC014265
Regd. Office: 83/86 GIDC Industrial Estate, Nadiad 387001, Gujarat
Tel.: 0268-2551381/2 Fax.: 0268-2555068;
E-mail: info@adf-foods.com; website: www.adf-foods.com

Notice is hereby given pursuant to Regulation 29 read with Regulation 47 of SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015 that a Meeting of the Board of Directors of the Company will be held in Mumbai on Monday, 24th May, 2021 at 03:30 P.M., inter-alia, to consider and approve the Audited Financial Results of the Company for the Fourth Quarter and Financial Year ended 31st March, 2021 and also to consider recommendation of Final Dividend on the equity shares of the Company for the F.Y. 2020-21, if any subject to approval of the shareholders in the ensuing Annual General Meeting. The said notice may be accessed on the Company's website at www.adf-foods.com and may be accessed at BSE website at www.bseindia.com and at NSE website at www.nseindia.com.

For ADF Foods Ltd. Sd/- Shalank S. Ovalekar
Place: Mumbai
Date : 13th May, 2021 Company Secretary & Compliance Officer

SHREE N.M.GOPANI POLYTECHNIC INSTITUTE

Managed by Ranpur SarvaJanik Education Society
AICTE Approved, GTU affiliated & ISO Certified Institute
Ranpur - Kinara, 382245, Dist:- Botad
Email: nmgpranpur@gmail.com Website: www.nmgp.co.in
Phone: 9909755290

FACULTY APPOINTMENT

Principal - 01		
Engg. Dept	HOD	Lecturer
Automobile	01	03
Civil	00	03
Electrical	01	03
Mechanical	01	08
Metallurgy	01	02

Qualification, Experience & Pay Scale as per AICTE & GTU norms
Interested Candidate send his / her application to the Director as per above mention address with photograph & Necessary Document up to 28-05-2021
Sd/-
Superintending Engineer (CG)
INF/BCH/94/21-22)

